


અપિલેખ્સી



વાઈ એંચ મીરગી આંચકી

ડૉ. નિશાંત એ. સૈની

એમ. ડી. (સાઇકયાટ્રી) - મનોચિકિત્સક

માનસિક, મગજ, વ્યસન મુક્તિ અને મનોજાતિય રોગોના નિષ્ણાત
સાનિદ્ધ માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ, પાલનપુર

- એપિલેપ્સી વાઈ, ખેચ, તાણા, આંચકી, મીરગી, કન્વલઝન અને ફિટ જેવા વિવિધ નામે ઓળખાય છે. એપિલેપ્સી એટલે વારંવાર આવતી ખેચ. એકજ વાર આવેલી ખેચને એપિલેપ્સી કહેવાય નહીં.
- વાઈએ મેલી શક્તિઓ, વળગાડ કે પ્રકોપ થી થતો રોગ નથી.
- આ મગજનો એક પ્રકારનો રોગ છે. વાઈજાનતંતુઓની નબળાઈની નિશાની કે લક્ષણ માત્ર છે. મગજના વિવિધ વિભાગોમાં થોડીક જ વાર માટે વિજણીક તરંગો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થવાથી શરીરમાં દુઃખી કે ઝટકા આવે છે.
- આશરે 100 માંથી 1 બ્યક્ટિને આવી બીમારી હોઈ શકે છે.
- એપિલેપ્સીના 70 % થી 75 % કિસ્સાઓમાં આ બીમારી નાનપણાથી જ થતી હોવાનું જાણવા મળેલ છે.
- એક તારણ મુજબ 100 માંથી 4 બ્યક્ટિને જુંદામાં એકવાર તો ખેચ આવી જ હોય છે.
- આજના આધુનિક યુગમાં એપિલેપ્સીની સારવાર શક્ય છે. જો યોગ્ય સારવાર લેવામાં આવે તો સ્વસ્થ સામાન્ય જીવન જીવી શકાય છે. 50 % જેટલા દર્દીઓને તો દવા લેવાથી ત્રણ થી પાંચ વર્ષ ખેચ કાયમ માટે બંધ થઈ જતી હોય છે.
- આ પુસ્તક દ્રારા એપિલેપ્સી વિધેની સરળ અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
- એપિલેપ્સીને સમજુએ અને તેની યોગ્ય સારવાર કરાવવાનો પ્રયાસ આજથી કરીએ તેવા ઉદ્દેશથી આ પુસ્તક સમાજને સમર્પિત.

ડૉ. નિશાંત એ. સૈની
એમ. ડી. સાઇકાટ્રી

(૧) વાઈ ઓટલે શું ?

- વાઈ એપિલેપ્સી ગીક ભાષામાંથી ઉતારી આવેલો શબ્દ છે. જેનો અર્થ નબળાઈ, તાણા અથવા આંચકીના હુમલાથી ગ્રસ્ત થવાની સ્થિતી થાય છે.
- તેને મેડીકલની ભાષામાં એપિલેપ્સી કન્વલગ્ન કહે છે.
- એપિલેપ્સી વાઈ, ખેંચ, તાણા, આંચકી, મીરગી, કન્વલગ્ન કહે અને ફિટ જેવા વિવિધ નામે ઓળખાય છે.
- વાઈ એ મેલી શક્તિઓ કે પ્રકોપ થી થતો રોગ નથી.
- આ એક પ્રકારની મગજની બિમારી છે. એટલે જ અંધશ્રેદ્ધામાં પડ્યા વગર તેની મગજના ડોક્ટર પાસે યોગ્ય સારવાર કરાવો.

(૨) વાઈનો હુમલો ઓટલે શું ?

- આપણું મગજ ધણું જ જટીલ અને સંવેદનશીલ અંગ છે. આપણી સધળી કિયાઓને એ નિયંત્રિત કરે છે.
- મગજના કોષો વિજણીક તરંગો દ્રાશ સંદેશાઓની આપલે કરીને સાથે મળીને કામ કરે છે.
- ધણીવાર અમુક કોષોના સમુહો વચ્ચે અસામાન્ય વિજણીક તરંગો પ્રવાહિત થાય છે, જેને કારણો તાણાનો હુમલો થાય છે.
- આ અસામાન્ય વિજણીક તરંગોનો પ્રવાહ મગજના જે ભાગમાંથ્યો હોય તેના ઉપર તાણાના હુમલાના પ્રકારનો આધાર રહે છે.

(૩) કયા પ્રકારની વ્યક્તિઓને વાઈ થાય છે ?

- સમાન્ય રીતે કોઈ ચોક્કસ સંજોગોમાં કોઇને પણ તાણા આવી શકે છે.
- આપણા દરેકના મગજમાં તાણા બિંદુ હોય છે, જે આપણાને થોડે ધણો અંશો તાણાના હુમલા સામે પ્રતિકારકતા બદ્ધ કરે છે.
- તાણાના હુમલાના અનેક કારણો હોઈ શકે છે જેવા કે મગજ ઉપર ઈજા, વિષપ્રકોપ, મસ્તક પર ઈજા કે આધાત અને આ સર્વે કારણો કોઈ ખાસ વય સમુહુને વ્યક્તિને જાતિમાં જ સિમિત નથી અને તેજ પ્રમાણે વાઈપણા.

(૪) વાઈકેટલા લોકોને હોય છે?

- આપણે સૌ માનીએ છીએ તેના કરતાં વાઈવધુ પ્રમાણમાં જોવા મળે છે.

- આશરે 100 માંથી 1 વ્યક્તિને આવી બીમારી હોઈ શકે છે.
- એપિલેપ્સીના 70 % થી 75 % કિસ્સાઓમાં આ બીમારી નાનપણાથી જ થતી હોવાનું જાણવા મળેલ છે.
- એક તારણ મુજબ 100 માંથી 4 વ્યક્તિને જુંદગીમાં એકવાર તો ખેંચ આવી જ હોય છે.

(૫) શું વાઈ કોઈ ખાસ ઉમર ત્રાટકે છે ?

- વાઈકોઈપણ ઉમરે આવતી હોય છે.
- એપિલેપ્સીના 70 % થી 75 % કિસ્સાઓમાં આ બીમારી નાનપણાથી જ થતી હોવાનું જાણવા મળેલ છે.
- જોકે મોટાભાગના જે લોકોને તેમના શરૂઆતના વર્ષોમાં આંચકી લાગુ પડી જાય છે, તે લોકોને ઉમર વધવાની સાથે તેમની તાણના હુમલાની તિંગતા અને પુનરાવર્તનમાં ઘટાડો અનુભવતા હોય છે.

(૬) વાઈ શા કારણે થાય છે?

વાઈથવાનું કોઈ એક કારણ નથી, ભગજના ઝાન કોષોને અથવા તેમની આસપાસમાં થતી સંદેશા વ્યવહાર પ્રણાલિને કેટલાય પરિબળો ઈજા પહોંચાડી શકે છે. 65 % કેશમાં કોઈ કારણ જણાતું હોતું નથી. અવારનવાર ઓળખવામાં આવેલા કારણો નીચે મુજબ છે:

- માથાની ઈજા કે ભગજના કોષોમાં ઘસરકો લાગવો.
- બાળકના જન્મ વખતની ઈજા કે ઓક્સિજનની ઉણાપ
- જન્મ સમયે આધાત કે ઊંઘ તાવ
- નવજાત શિશુની વધારે પડતી કઠોરતા પૂર્વક હડ્ડોડ અથવા હલાવવું.
- ભારે માત્રામાં અપાયેલા કેટલાક ઔષધો કે વિધાકત પદાર્થો.
- આધાત, ટયુમર, કેન્સર, ગાંઢ અથવા રક્તાનલિકાઓની કેટલીક વિકૃતિઓ.
- રક્તની સમતુલા અથવા રાસાયણિક બંધારણને બદલી નાખતા રોગો અથવા ભગજના ઝાન કોષોને નુકશાન પહોંચાડતા રોગો.
- ભગજનો તાવ કે ભગજમાં ચેપી રોગ થવો જેમ કે ટી.બી., એઈડ્સ, મેનીજાઇટીસ, એનકેફેલાઇટીસ, ભગજનું વાઈરલ, બેક્ટેરીયલ કે ફુંગલ ઈન્ફેક્શન ચેપ.

- વારસાગત કારણો.
- લોહીમાં સુગર ખાંડનું પ્રમાણ ઘટવું.
- ⇒ ઉપર દર્શાવેલ કારણોમાંથી એક પણ કારણ લાગુ પડતું ન હોય એવા કિસ્સામાં પણ એપિલેપ્સી જોવા મળે છે.

(૭) શું વાઈ વારસાગત હોય છે ?

- મોટાભાગના કિસ્સાઓમાં વાઈ વારસાગત હોતી નથી.
- અમુક જુજ કિસ્સાઓમાં વાઈની લાક્ષણિકતા ક્યારેક વારસાગત જણાય, પણ આ લાક્ષણિકતા હોવા છતાં મગજમાં સવિશેષ અવસ્થા હોવી જરૂરી છે. જેના થકી વ્યક્તિ વાઈની તાણાનો અનુભવ કરી શકે.
- બાળકો આ રોગ વારસામાં મેળવે એ શક્યતા નહિવત હોય છે.

(૮) શુ વાઈ ચેપી છે ?

- વાઈ કોઈપણ રીતે ચેપી નથી.
- પરસ્પર વાત કરવાથી કે સ્પર્શ કરવાથી કોઈને વાઈ ન થઈ શકે.
- ફક્ત વંશ પરંપરાગત રીતે જ વાઈ આગળ પ્રેરીત કરી શકાય છે.
- જે પરિવારમાં વાઈ વારસાગત આવે છે તે કારણ ભૂત શરીર બંધારણાની પ્રક્રિયા અથવા જૈવિક કારણોનો નિર્દેશ કરે છે અને વાઈને લગતા નિઝનતમ કારણોમાંથી આ એક કારણ છે.

(૯) શુ વાઈ વાઈરસને કારણે થાય છે ?

- વાઈ સંક્રમાત અથવા કોઈ રોગને કારણે પણ હોઈ શકે છે.
- મેનિન્જાઇટીસ, વાઈરલ એન્સેફેલિટીસ અને ગાલપચોળીયા દ્વારા ક્યારેક જ અછબડા, ડિસ્ટ્રીટરીયા અને શરીરના પોલાણમાં પરુ ભરાવવાના કારણો જેવી પરિસ્થિતીને કારણે વાઈ થઈ શકે છે.

(૧૦) તાણ બિંદુ (સિઅર થેશોફ્ટ-Seizure threshold) એટલે શું ?

- આપણા દરેકના મગજમાં તાણ બિંદુ હોય છે, જે આપણને થોડે ધરો અંશો તાણાના હુમલા સામે પ્રતિકારકતા બખે છે.
- આ તાણ બિંદુ મા કેટલાક સંજોગોમાં ફેરફાર થતા વ્યક્તિને જેંચ આવી શકે છે.
- એપિલેપ્સીના દર્દીમાં તાણબિંદુ નોરમલ વ્યક્તિ કરતા નિચુ કામ કરતું હોય છે. આ કારણ થી જ શરીરમાં સામાન્ય ફેરફાર થતા કે

ગરબડ થતા ખેંચ આવી જતી હોય છે.

(૧૧) વિશિષ્ટ લક્ષણ ઓરા એટલે શું ?

- આંચકી આવતાં પહેલાં કેટલાક લોકો ખાસ પ્રકારના સંવેદનો અથવા ચેતવણીનો અનુભવ કરે છે. જેને ઓરા વિશિષ્ટ લક્ષણ કહેવાચ છે. આ વિશિષ્ટ લક્ષણ અગાઉથી વ્યક્તિને થતા શક્યત ઈજા થતી ટાળી શકાય છે.
- વ્યક્તિ વ્યક્તિ ને વિશિષ્ટ લક્ષણોના પ્રકારનો અનુભવ અલગ અલગ થતો હોય છે. જેમ કે શરીરમાં ગરમી વધવી, ઉશ્કેરાટ કે બેચેનીનો અનુભવ થવો, સંગ્રિતમય દવનિ, ચિત્ર વિચિત્ર સ્વાદ અથવા તો કોઈ વિચિત્ર પ્રકારની ગંધનો અનુભવ થવો.
- ઓરાના લક્ષણના વર્ણન પરથી મગજના કચા ચોક્કસ ભાગમાં શરૂઆતમાં ખેંચ ઉત્પન્ન થાય તેની માહિતી મેળવી શકાય.

(૧૨) તાણના હુમલા કેવા હોય છે ?

- વ્યક્તિને કચા પ્રકારની વાઈ તેની ઉપર તાણના હુમલાનો ફેરફાર જણાય છે.
- અમુક તાણના ચિનહો જોઈ શકાય છે. જ્યારે અમુક તદ્દન ઓળખી શકતા નથી.
- વ્યાપક પ્રકારના તાણના હુમલાઓમાં થોડા ઘણો અંશો સભાનપણું ગુમાવાય છે. પરંતુ કેટલીક તાણના હુમલાઓ વખતે શરીરના અંગોનું માભુલી હલન ચલન અથવા ન સમજી શકાય તેવી લાગણીઓ થાય છે. વિલિન્ન તાણના હુમલાઓની ચોક્કચ લાક્ષણિકતાઓ તેમની સાથેજ રહે છે
- અમુક દર્દીઓમાં બે પાંચ મિનિટ માટે ખેંચ આવે, જે દરમ્યાન :
 - > દર્દી બેહોશ થઈ જાય છે.
 - > કચારેક જીબ કચડાઈ જાય છે.
 - > કચારેક દાંત બંધાઈ જાય છે, કોઈકવાર દાંત પડી પણ જાય છે.
 - > કચારેક કપડામાં પેશાબ કે સંડાસ થઈ જાય છે.
 - > કચારેક હાથ, પગ અને શરીર ઝટકા મારે છે.
 - > કચારેક હાથ, પગ અને શરીર લાકડા જેવું અક્ષ્યદ થઈ જાય છે.
 - > કચારેક દર્દી ધમપણાડા કે સામે પણ થઈ જાય છે.
 - > દર્દીને ખેંચ બાબતે કશી ખબર હોતી નથી.

- કેટલીક તાણના હુમલાઓ વખતે :
 - શરીરના અમુકજ અંગોનું મામુલી હલન ચલન થવું.
 - એકાદ પળ માટે બેભાન થઈ જવું.
 - અચાનક હાથ માંથી વસ્તું પડી જવી.
 - એકાદ પળ માટે આંખો અચાનક જ બંધ થઈ જવી.
 - અચાનક બોલતા બોલતા શુન્યમનસ્ક થવું
જેવા લક્ષણો જેવા મળતા હોય છે.

(૧૩) તાણના હુમલા વખતે શું અનુભવાય છે ?

- વિભિન્ન વ્યક્તિઓની તાણના હુમલા સાથે સંકળાયેલા સંવેદનોમાં અચોકસઈપણું, ગભરાહટ, શારીરિક અને માનસિક થાક, મુંજવણ અને સ્મૃતિભંશનો સમાવેશ થાય છે.
- કેટલાક પ્રકારના તાણના હુમલા વખતે દ્રષ્ટિગત અને શ્રવણગત ઇન્ડ્રિયગમ્બ્ય વિલક્ષણતા ઉત્પન્ન થાય છે.
- જ્યારે કેટલાક લોકોને ખાલીપણાની લાગણી થાય છે. જો તાણના હુમલા વખતે વ્યક્તિ બેશુદ્ધ હોય તો તેને કશી સંવેદના થતી નથી.
- ઘણાય લોકો તાણના હુમલા પહેલાં વિશિષ્ટ લક્ષણો ઓરાનો અનુભવ કરે છે.

(૧૪) શું તાણના હુમલાના વિવિધ પ્રકારો હોય છે.? .

- વાઈની તાણના હુમલા વિવિધ પ્રકારે ઉદ્ભવે છે અને તેનું પુનરાપર્તન તથા આકમણાના પ્રકાર પ્રત્યેક વ્યક્તિ માટે લિન્ન હોય છે.
- આધુનિક ચિકિત્સા પદ્ધતિ મુજબ જો કે મોટાભાગના કિસ્સાઓને સંપુર્ણપણે નિયંત્રિત કરી શકાય છે.
- ખેંચના મુખ્ય ચાર પ્રકારો છે:
 - 1) વિસ્તારિત વિસ્તૃત પ્રકારની ખેંચ (જનરલાઇઝડ સીકર)
 - 2) સીમિત આંશિક પ્રકારની ખેંચ (પાર્સિયલ સીકર)
 - 3) અનિર્ણિત (અનકલાસીફાઇડ)
 - 4) સ્ટેટ્સ એપિલેપ્ટીકસ
- આ પ્રણાલિએ બંને પ્રકારોનું પેટા વગ્નીકરણ કર્યું છે, જેમાં :
 - એક પક્ષિય.
 - એક પક્ષિય જટિલતા પૂર્ણ.
 - શુન્ય મનસ્કતા.

- ટોનિક કલોનિક.
- અને અન્ય પ્રકારો.

(૧૫) જનરલાઈઝ્ડ સીઅર(વિસ્તૃત પ્રકારની ખેંચ)

ના પ્રકારો ક્યા ક્યા છે. ?

(૧) ગ્રાન્ડમાલ એપિલેપ્સી (આખ શરીરની ખેંચ) :

- આ પ્રકારમાં માણસ બેભાન થઈ જાય છે, ક્યારેક ચીસ પાડે છે, મોઢામાંથી ફીણ આવે, શરીરમાં ઝટકાઆવે, કોઈકવાર જીબ કચરાય, બત્રીસી બંધાઈજાય તો ક્યારેક કપડામાં ઝાડા પેશાબ થઈ જાય છે.
- આ પ્રકારની ખેંચને મોટી ભારે ખેંચ કહેવાય છે.
- ભાનમાં આવ્યા પણ દર્દી થોડીવાર માટે અર્દજગત કે તંત્રામાં રહે છે. થોડા સમય માટે લક્વો થઈ શકે છે.
- કેટલાક દર્દીઓને ભાનમાં આવ્યા પણ માથું દુખવુ, ઉલટી ઉબકા કે પેટમાં દુખવુ, ચસ્કર આવવા, શરીર કમજોર લાગવુ તુટવુ કે દુખવુ, ચાદશાકિત જતી રહેવી તેમજ અન્ય શારીરિક તકલીફો થોડા કલાકો માટે જોવા મળતી હોય છે.
- મોટાબાગના કિસ્સાઓમાં દર્દીને ખેંચ દરમિયાન શું થયું તેની ખબર હોતી નથી.
- કેટલીક વાર ખેંચ આવતા પહેલા દર્દીને સંકેત મળી જતો હોય છે જેને ઓરા કહે છે.

(૨) પેટિટમાલ એપિલેપ્સી (એબસન્સ સીઅર) :

આ પ્રકારની ખેંચમાં દર્દી અમુક સમય માટે ક્ષુબ્ધ, સ્તત્વદ્વારા, શૂન્યમનસ્ક અને વિશ્વિસ બની જાય છે.

(૩) માયોકલોનિક સીઅર :

આ પ્રકારની ખેંચમાં દર્દીને હાથ પગમાં ક્ષાણિક ઝાટકા આવે છે અને હાથમાંથી વસ્તું પડી જાય છે. દર્દી હોશમાં હોય છે.

(૪) ટોનિક કલોનિક અને એકાઇનેટિક.

(૧૬) પાર્સિયલ સીઅર (સીમિત આંશિક પ્રકારની ખેંચ) ના પ્રકારો ક્યા ક્યા છે ?

(૧) સિમ્પલ પાર્સિયલ સીઅર :

- આ પ્રકારમાં દર્દી સભાન હોય છે અને શરીરનું એક બાજુનું અંગ જેચાય છે. અથવા ઝણાકળાટી થાય છે.

(૨) કોમ્પ્લેક્સ પાર્સિયલ સીડર :

- જ્યારે સિમ્પલ પાર્સિયલ સીડર જેવા લક્ષણો સાથે દર્દી ક્ષાણિક ભાન ગુમાવે તો તેને કોમ્પ્લેક્સ પાર્સિયલ સીડર કહે છે.
- આ પ્રકારમાં દર્દી ક્ષાણાભર માટે ભાન ગુમાવી હોય તો કચારેક વિચિત્ર વર્તણૂક કરે અને પછી તરતજ ભાનમાં આવી જાય છે.
- આ પરિસ્થિતિને નાની ખેંચ પણ કહે છે.

(૧૭) શૂન્યમનસ્કપણું (પેટિટ માલ) ઓટલે શું ?

- વ્યાપક રીતે શૂન્યમનસ્કપણા દરમિયાન પાંચ થી પંદર સેંકડ સુધી સભાનતાનો ભંગ થાય છે.
- આ સમય દરમિયાન દર્દી અવકાશમાં જોતો હોય તેવું લાગે છે તેની આંખો ઉપર ચડી જઈ શકે છે. શૂન્યમનસ્કતા પૂર્વે તેના વિશિષ્ટ લક્ષણો ઓરા જણાતા નથી અને વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ તરતજ શરૂ કરી શકે છે.
- લાક્ષણિક રીતે એ ભાળકોમાં ઉદ્ભબે છે અને કિશોરવસ્થા આવતા મટી જાય છે.

(૧૮) ટોનિક કલોનિક (ચાન્ક માલ) શું હોય છે.?

- આ વ્યાપક પ્રકારની તાણ છે જે બે તબક્કામાં આવે છે.
- ટોનિક તબક્કામાં વ્યક્તિ ભાન ગુમાવી બેસે છે અને પડી જાય છે અને શરીર અકડાઈ જાય છે.
- કલોનિક તબક્કામાં શરીરના હાથ પગ ઝટકાય છે અને દ્યુજારી થાય છે. આ તાણના હુમલા બાદ ભાન ધીરેધીરે પાછું આવે છે.
- જો કે ટોનિક કલોનિક તાણનો હુમલો વધારે સ્પષ્ટ હેખાય છે અને વાઈનો સ્પષ્ટ પ્રકાર છે. તે સૌથી વ્યાપક પ્રમાણમાં નથી

(૧૯) સ્ટેટસ એપિલેપ્ટીકસ ઓટલે શું ?

- જ્યારે દર્દીને લગાતાર અડધા અડધા કલાકથી પણ વધારે સમય ખેંચના હુમલા ચાલુ રહે અથવા વારંવાર થતા ખેંચના હુમલાઓ વચ્ચે દર્દી બેભાન રહેતો હોય એ ગંભીર પરિસ્થિતિને સ્ટેટસ એપિલેપ્ટીકસ કહે છે.

- આ એક ઇંમરજન્સી હોવાથી દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી રેવી જોઈએ.

(૨૦) ફેબ્રાઇલ કન્વલઝન એટલે શું ?

- ફેબ્રાઇલ કન્વલઝન એટલે તાવપ્રેરિત ખેંચ.
- કેટલીક વાર નાના બાળકોને તાવમાં કથારેક સામાન્ય ખેંચ આવતી હોય છે.
- સામાન્ય રીતે બાળક પાંચ વર્ષ પૂરાં કરે પછી આવી ખેંચ આપોઆપ મટી જાય છે.
- આવા કિસાઓમાં મગજને કોઈ હાનિ થઈ છે કે નહિ તેની ખાતરી કરી રેવી જોઈએ
- આ પ્રકારની ખેંચ અટકાવવા બાળકને તાવ ન ચેકે તેની પૂરી તકેદારી રાખવી જોઈએ.
- આવી ખેંચો અટકાવવી જરૂરી છે કેમકે વારંવાર ખેંચ આવે તો ભવિષ્યમાં ૧% દર્દીઓમાં સિમ્પલ પાર્સિયલ કે જનરલાઈર્ડ સીઝરના હુમલા થઈ શકે છે.

(૨૧) અનિયંત્રિત ખેંચ કે રિફેક્ટરી એપિલેપ્સી એટલે શું ?

જ્યારે મુખ્ય દવાઓ યોગ્ય યેઝાનિક માર્ગદર્શન મુજબ વાપરી ચૂક્યા હોઈએ અને દવાઓનું યોગ્ય સંયોજનો, યોગ્ય માત્રામાં યોગ્ય સમય સુધી વાપરવા છતાં પણ ખેંચ વાઈની જરૂરી નિયંત્રણ થાય નહિ તો તેને અનિયંત્રિત ખેંચ કે રિફેક્ટરી એપિલેપ્સીકે ઈન્ફ્રોક્ટેબલ એપિલેપ્સી કહેવાય છે.

આવું નક્કી કરતાં પહેલા નીચેની બાબતો ચકાસવી જોઈએ :

- આ રોગ ખેંચનો જ છે ને ? એપિસેપ્સીનું યોગ્ય નીદાન થયેલું છે તેની ફરી ચકાસણી કરવી જોઈએ.
- આ રોગની દવા ખેંચના પ્રકાર પ્રમાણો આપેલ છે તેની ફરી ચકાસણી જોઈએ.
- આ રોગની દવા યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં અપાયેલ છે તેની ચકાસણી કરવી જોઈએ. દવાની માત્રા દર્દીના વજન અને ઉભર પ્રમાણો તેમજ દવા લેવાનો સમય પણ ખેંચને કાબુમાં લાવવા મહત્વના છે.

- આ રોગની દવા દર્દીએ બરાબર સુચયવ્યા પ્રમાણે સમયસર લીધેલ છે કે નહિ તેની ચકાસણી પણ કરવી જોઈએ.
- આ કારણોની ચકાસણી કર્યા પછી યોગ્ય ઐજાનિક માર્ગદર્શન હેઠળ જેંચની બે અલગ અલગ મુખ્ય દવાઓના સંયોજનનો પ્રત્યેક છ મહિનાનો યોગ્ય માત્રાનો કોર્સ તેમજ કમ સે કમ એક સંયોજન ચુક્ત દવાઓને છ મહિનાનો કોર્સ અજમાવી જોવા છતાં જો દર મહિને એકથી બે જેંચ બે વર્ષ સુધી આવ્યાજ કરે તો તેને અનિયંત્રિત જેંચ કહે છે.
- જેંચના તમામ દર્દીઓમાંથી આશરે ૧૫ થી ૨૦ ટકા દર્દીઓ આવા હોય છે.

(૨૨) એક પક્ષિય અને વ્યાપક તાણા વરચે શું તફાવત છે ?

- મગજમાં વિધુત પ્રવાહ એકજ તરફ થાય તો તાણાનો હુમલો એકપક્ષિય કહેવાય છે. જ્યારે તેમાં સમગ્ર મગજ સામેલ હોય તો તે વ્યાપક પ્રકાર ગણાય છે.
- એક પક્ષિય તાણાના હુમલા વખતે દર્દીને ચિત્ર વિચિત્ર અને અસામાન્ય પ્રકારની શ્રેણીબદ્ધ સંવેદનાઓનો અનુભવ થાય છે જેમ કે
 - શરીરના કોઈ એક અંગનું અચાનક આંચકા સાથે હલન ચલન કે દ્યુજારી થવી,
 - કોઈ એક તરફના હાથ, પગ, મોઢા કે શરીરમાં ઝણાઝણાટી કે સુન પડવા,
 - સાંભળવામાં કે દ્રષ્ટિમાં વિકૃતિકરણ,
 - પેટમાં ગરબડ અથવા અચાનક ભયની લાગાણી થવી.
- એકપક્ષિય તાણાના હુમલા વખતે સભાનપણું બગડતું નથી. જો આના પછી અન્ય પ્રકારની તાણાનો હુમલો આવે તો આ સંવેદનો વિશિષ્ટ લક્ષણ ઓરા તરીકે ઉલ્લેખ થાય છે.
- એક પક્ષિય જટિલ તાણાના હુમલા વખતે દર્દી હતપ્રત થયેલો કે મુંઝાએલો જણાય છે. ઉદ્ઘાયિહનિ વર્તન જેવુંકે અવિરત ચાલ્યા કરવું, બડબડાટ, માથું ધુમાવ્યા કરવું અને કપડા જોય્યા કરવા જેવી પ્રવૃત્તિ દર્દીમાં જોવા મળે છે. બાળકોમાં આ પ્રકારની તાણાનો હુમલો એકીટો જોચા કરવું કે હોઠ ચાટ્યા કરવાની વૃત્તિમાં જોવા મળે છે.

(૨૩) સાયકોજેનિક સીઅર કે હિસ્ટેરીયા એટલે શું ?

- વાઈજેવા લક્ષણો ધરાવતો બીજો એક રોગ હિસ્ટીરીયા (સોમેટોફોર્મ કન્વર્ગન રિએક્શન) છે.
- વાઈઅને હિસ્ટીરીયા બંને અલગ રોગો છે. વાઈએ મગજની બિમારી છે. જ્યારે હિસ્ટીરીયા એ માનસિક બિમારી છે.

→ હિસ્ટીરીયામાં વિવિધ લક્ષણો જોવા મળતા હોય છે જેમ કે,

- માતા આવવી,
- દાંત બંધાઈજવા,
- અચાનક બોલવાનું બંધ થઈજવું,
- શ્વાસ લેવામાં તકલીફ,
- શરીરના અવયવોમાં દ્યુખારી થવી,
- શરીરના અમુક ભાગમાં જોયાણ થવું,
- બેભાન થઈ જવું વગેરે મુખ્ય લક્ષણો છે.
- આ રોગમાં જુદા જુદા સમયે રોગના લક્ષણો બદલાતા રહે છે.
- પોતાની માનસિક પીડા તરફ લોકોનું દ્યાન ખેંચવા, સહાનુંભૂતિ મેળવવા કે અણાગમતી જવાબદારીથી છુટકારો મેળવવા દર્દીને હિસ્ટેરીયા થઈ જાય છે.
- ખાસ કરીને યુવાન, પરિપક્વ, નાની નાની બાબતો માટે બીજા પર આધાર રાખતા કે બીજાના અભિપ્રાયથી જલ્દી દોરવાઈ જાય તેવી નાટકીય સ્ત્રીઓ કે કન્યાઓમાં તણાવ જનક પરિસ્થિતીઓમાં હિસ્ટેરીયા થાય છે.
- ધર્મિવાર દર્દીની જરૂરીયાતો સંતોષાતા કે નાટકીય સંજોગોમાં રોગ એની મેળે ભટી જાય છે.
- આપણે ત્યાં હિસ્ટેરીયાને વળગાડ કે માતા રૂપે ઓળખવામાં આવે છે. નવરાત્રી, સાતમ, આઠમ કે નોમ, લગ્ન પ્રસંગો કે અન્ય ધાર્મિક વિધીને ઉત્સવો વખતે ચિંતાજનક પરિસ્થિતિમાં દર્દી દ્યુણો છે. તે પોતે કોઈ દેવ, દેવી, પ્રેતાત્મા, જીન ચુકેલ કે પુર્વજ છે એવો દાવો કરે છે એવી રીતે વર્તે છે ભવિષ્યવાણીઓ કરે છે, અન્ય ભાષામાં વાત કરે છે, બલીદાન માંગો છે. કે વસ્તુઓ માંગો છે.
- દર્દીના રોગના લક્ષણો ઉપર દ્યાન આપવું નકામું છે. તેમ કરતાં તેની તકલીફ વધતી જાય છે. દર્દ ઉપરે ત્યારે ખરેખર તો મનોચિકિત્સક

જોકે યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે.

(૨૪) એપિલેપ્સી ન હોય તો પણ જેંચ આવી શકે ?

- હા, કેટલાક કિસ્સાઓમાં એપિલેપ્સી ન હોવા છતા પણ જેંચ આવી શકે છે.
- એકજ જેંચ આવવી એ એપિલેપ્સી નથી.
- શર્કરા ઘટી જવાથી કુદ્દું રોગ, ચક્કર આવવાથી, માઈન્ચેન નો દુખાવો શરૂ થતા, સ્ટ્રોક આવવાથી, નાકેલિપ્સી, કેફીડ્રબ્યુ કે દવાનો ઓવર ડોઝ અને એકદમ આધાત, સ્ટ્રેસ કે ચિંતા વધી જવાથી પણ જેંચ આવતી ઓય છે.
- આ પ્રકારની જેંચમાં જેંચ આવ્યા પછી કોઈપણ અસામાન્ય વિજળિક તરંગો જોવા મળતા નથી.
- આ પ્રકારની જેંચ વારંવાર આવતી નથી.
- આ પ્રકારની જેંચમાં લાંબો સમય સુધી દવા લેવાની જરૂર નથી હોતી.

(૨૫) શું અળકતા પ્રકાશથી તાણની ઉશ્કેરાણી મળે છે ?

- ટમટમતા કે ઝળકતા પ્રકાશથી ઉતેજીત થતી તાણના પ્રકારને પ્રકાશ સંવેદનાત્મક વાઈક્ઝ ફોટો સેન્સિટીવ એપિલેપ્સી કહેવાચ છે.
- જોકે સામાન્યપણે પાંચ થી બાર વર્ષની છોકરીઓમાં આ પ્રકાર વધારે પ્રમાણામાં પ્રવતતો જોવા મળે છે.
- આ કોઈપણ વચ્ચે લિંગની વ્યક્તિત્વનેથિંદું શકે છે.

(૨૬) શું કોઈ ચોક્કસ ઘટનાઓ તાણના હુમલાનું પરિબળ બની શકે છે ?

- કેટલીક વાર વાઈના હુમલા વાતાવરણામાં નિર્ભિત થતા કેટલાક પરિબળોને લીધે પણ થાય છે.
- પ્રકાશના તિપ્રે ઝલકારાનો અથવા અંધારામાંથી પ્રકાશમાં આવવાના અચાનક પરિવર્તનના કારણે પણ તાણ ઉત્પન્ન થઈ શકે છે.
- કેટલાક લોકો ધોંઘાટ અથવા એકઘારા અવાજ અથવા સંગીતની કોઈ ચોક્કસ બંદિસ પ્રત્યે પણ પ્રતિક્રિયા ધરાવે છે.
- વાઈના દર્દીઓ શીખવું જરૂરી છે કે કચા પ્રકારના પ્રસંગો તાણને ઉશ્કેરી શકે છે. આ પરિબળોથી દુર રહેવું હિતાવહ છે.

(૨૭) અમુક ખાસ ખોરાક કે પીણાં તાણનું કારણ બની શકે ખરા ?

- વાઈના દર્દીએ સમતોલ ભોજન નિયમીત લેવું જોઈએ.
- ભોજનની અનિયમીતતા અને કેટલાક વિરુદ્ધ આહારો પણ તાણ લાવી શકે છે.
- વાઈના દર્દીએ કયારેક પણ ઉપવાસ કરવા જોઈએ નહિ.

(૨૮) ઉંઘની ઉણાપ તાણનું કારણ બની શકે ખરા ?

- ઉંઘની ઉણાપ કે અનિયમીતતા પણ કેટલીક વાર તાણ લાવી શકે છે.
- નિયમીત અને પ્રમાણાસરની ઉંઘ વાઈના દર્દીએ લેવી જરૂરી છે.
- વાઈના દર્દીએ ઉજાગરા કરવા જોઈએ નહિ અને રાતની નોકરી કે કામ કરવું જોઈએ નહિ.

(૨૯) શું લોહીમાં સુગર કે ગલુકોડના નીચા પ્રમાણને કારણે તાણ આવે ?

- લોહીમાં સુગર કે ગલુકોડના નીચા પ્રમાણને હાયપોગલાયસેમિયા કહેવાય છે જે વાઈજેવીજ તાણને પ્રેરીત કરે છે.
- આ પરિસ્થિતી ખોરાક કે ઈન્સચ્યુલિન જેવી દવાઓને કારણે પણ થઈ શકે છે.
- આ હંક્રિક્ષતમાં વાઈ નથી, કારણે મગજમાં અપ્રાકૃતિક ફેરફાર ને લઈને થતી આ તાણ લોહીમાં સુગરના ઘટાડાના કારણે થાય છે.

(૩૦) શરાબ આલ્કોહોલ તેમજ અન્ય કેફીદ્રબ્યોની અસર તાણ પર થાય ખરી ?

- શરાબ તાણ બિંધુને ઉપર તરફ લઈજઈને પછી નિયું લાવે છે અને આ રીતે તાણના હુમલાઓ થાય છે.
- આલ્કોહોલ વિથ્ડ્રોઅલમાં પણ જેંચ આવતી હોય છે.
- આ ઉપરાંત અમુક કેફીદ્રબ્યો જેવા કે કોકેઇન અને એમ્ફેટામાઈન્સ પણ તાણ લાવી શકે છે.
- વધુ પ્રમાણામા લેવાયેલી કેટલીક દવાઓ પણ તાણ લાવી શકે છે.

(૩૧) એપિલેપ્સીનું નિદાન કઈ રીતે થાય છે ?

- એપિલેપ્સીના નિદાન માટે સૌથી અગત્યની બાબત જેંચની

ક્રીએવટભરી માહિતી જેણો ખેંચ જોઈ હોય તે વ્યક્તિ પાસેથી ખેંચની સંપુર્ણ માહિતી એકત્રિત કરવી જોઈએ.

- ખેંચનો પ્રકાર, સારવાર પદ્ધતિ અને રોગ વિશેની વધુ માહિતી જાણવા માટે મગજનો ગ્રાફ ઈ.ઈ.જી., મગજનો ફોટો સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ. પણ જરૂરી બને છે.
- આ ઉપરાંત લોહીની તપાસ, મગજ અને છાતીના એક્સ રે જેવી અન્ય તપાસ પણ જરૂર લાગે તો કરાવવી પડતી હોય છે.

(૩૨) ઈ.ઈ.જી. એટલે શું ?

- ઈ.ઈ.જી. એટલે ઇલેક્ટ્રોએનસિફેલોગ્રાફી
- ઈ.ઈ.જી. મગજના વિજણિક તરંગોની ગ્રાફ ઉપર માહિતી આપે છે.
- ઈ.ઈ.જી. માં 18, 24, 34 ચેનલોનો રિપોર્ટ છે.
- વીડીયો ઈ.ઈ.જી. એ એક આધુનિક વિડીઓગ્રાફિક રિપોર્ટ છે.
- ઈ.ઈ.જી. એ એક પ્રકારનો મગજનો ગ્રાફ છે જે અસામાન્ય વિજણિક તરંગોનો પ્રવાહ મગજના જે ભાગમાં થયો હોય તેની માહિતી પુરી પાડે છે.
- ખેંચના નિદાનમાં ઈ.ઈ.જી. ફક્ત અસામાન્ય વિજણિક તરંગોની માહિતી પુરી પાડે છે અને નિદાનમાં મદદ રૂપ થાય છે.
- લગભગ 20 % જેટલા કિસ્સાઓમાં દર્દીને ખેંચ હોવા છતા ઈ.ઈ.જી. નોરમલ આવતો હોય છે.
- સામાન્ય રીતે ઈ.ઈ.જી. ખેંચની દવા શરૂ કરતા અને બંધ કરતા પહેલા કરાવવો હિતાવહ છે.
- ઈ.ઈ.જી. નોરમલ હોવા છતા ખેંચની સારવાર ડોક્ટરના કહ્યા મુજબ જ બંધ કરવી જોઈએ.

(૩૩) એપિસેપ્સીના નિદાનમાં કઈ કઈ આધુનિક સ્કેનિંગ પદ્ધતીઓ છે ?

- સી. ટી. સ્કેન (CT-SCAN) એ ત્રણ ડાઇમેન્શનમાં મગજની કોમ્પ્યુટરાઈઝડ માહિતી આપે છે.
- એમ.આર.આઈ. (MRI) ત્રણ ડાઇમેન્શનમાં મગજની કોમ્પ્યુટરાઈઝડ માહિતી મેગનેટીક ફિલ્ડ (વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર)માં આપે છે.

- એમ.આર.આઈ. સ્પ્રેક્ટ્રોસ્કોપી (MRI SPECTROSCOPY) મગજના કાર્યો અને બાયોકેમિસ્ટ્રીની માહિતી આપે છે.
- ફંક્શનલ એમ.આર.આઈ. (FUNCTIONAL MRI) મગજના વિવિધ વિભાગો ની કાર્યપ્રણાલીની નાનામાં નાની માહિતી આપે છે.
- પોસીટ્રોન ઇમ્બીસન ટોમોગ્રાફી સ્કેન (PET SCAN) મગજના લોહીના પ્રવાહ અને મેટાબોલીક્ષમની માહિતી પુરી પાડે છે. આ અત્યાધુનિક સ્કેનિંગ ટેકનીક છે.
- સિંગલ પ્રોટોન ઇમ્બીસન કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી સ્કેન (SPECT SCAN) મગજના લોહીના પ્રવાહ અને મેટાબોલીક્ષમની માહિતી પુરી પાડે છે. આ અત્યાધુનિક સ્કેનિંગ ટેકનીક છે. જે PET સ્કેન કરતા ઓછી ખર્ચાળ છે.
- આ બધી સ્કેનિંગ પદ્ધતિઓ એપિલેપ્સીનું નિદાન કરવામાં ડોક્ટરને માહિતી પુરી પાડે છે.
- એપિલેપ્સી હોવા છતાં મોટા ભાગના કિસ્સાઓમાં આ સ્કેનિંગ નોરમલ હોઈ શકે છે.

કોઈપણ રિપોર્ટ કરાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાનું ચુક્ષો નહિ

(૩૪) એપિલેપ્સીની સારવાર કઈ કઈ છે ?

- એપિલેપ્સીનું નિદાન થયા પછી તેની યોગ્ય સારવાર થવી જરૂરી છે.

⇒ દવાઓ :

- ખેંચ માટે વિવિધ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે.
- રોગના લક્ષણો અને પ્રકાર ઉપરથી ડોક્ટર દવા નાંકી કરે છે. છેલ્લા કેટલાક વધોથી આ રોગ અંગે ઘણા નવા સંશોધનો થઈ રહ્યા છે અને રોગનિવારક નવી નવી દવાઓ તથા ઓપરેશનો શોધાયા છે.
- ફેનીટોઇન, ફિનોબાર્બિટોન, કાર્બોમેટ્રેપિન અને વાલ્પ્રોએટ જેવી દવાઓ મુખ્ય જનરેશનની દવાઓ છે.
- ગાબાપેન્ટીન, લેમોટ્રિક્ઝીન, ટોપીરામાઇડ, વિગાબેટ્રીન અને ફેલલબેમેટ જેવી દવાઓ સેકન્ડ જનરેશનમાં આવે છે.
- ઓક્ષકાર્બોમેટ્રેપિન, લીવાટીરાસાટ.૧૧. ઓનીસેમાઇડ, લેકોસેમાઇડ અને એસલીકાર્બોમેટ્રેપિન જેવી દવાઓ થ્રી જનરેશનમાં આવે છે.

- મુખ્ય દવાઓ ચોગ્ય માત્રામાં માર્ગદર્શન પ્રમાણે આપવામાં આવતી હોય છે. અન્ય જનરેશનની દવાઓ ખેંચના લક્ષણા, પ્રકાર, સમય મર્યાદા પ્રમાણે મુખ્ય દવાની સાથે ચોગ્ય સંચોજનમાં કે બદલીમાં વાપરવામાં આવે છે.
- આ બધી દવાઓ ચોગ્ય સંચોજન અને સમય સુધી વાપર્યો પછી પણ ખેંચનું જરૂરી નિયમન થાય નહિતો તેને અનિયંત્રિત ખેંચ કરેવાય છે. આવા કિસ્સામાં નવી દવાઓ કે ઓપરેશનો વિકલ્પ અપનાવવો જોઈએ.

⇒ ઓપરેશન :

- ઓપરેશન નિયેની બે શક્યતામાં કરી શકાય
 - 1) જ્યારે દવાઓથી ચોગ્ય પરિણામ ન મળે.
 - 2) મગજમાં ખેંચના કારણારૂપ ઇલેક્ટ્રિકલ કે સ્ટક્યરલ ફોકસ મળી આવે.
- ખેંચની સર્જરી સ્ટેટ્રે આધુનિક યુગમાં સંતોષજનક પ્રગતિ થઈ છે.
- જે કિસ્સાઓમાં ખેંચનું ફોકસ મળેલ હોય તેવા ફોકસ ઓપરેશન માટે લાયક દર્દીઓમાં ઓપરેશનથી ખેંચનું પૂર્ણ નિયમન આવે છે.
- ખેંચ માટે નીચે મુજબના ઓપરેશનો ઉપલબ્ધ છે. કચા કેશામાં કચુ ઓપરેશન કર્યું તે તો એપિલેપ્સી સેન્ટરના અનુભવી ન્યુરોલોજિસ્ટ ન્યુરો સર્જનની ટીમ જ નક્કી કરે છે.

(૧) રિસેક્ટીવ સર્જરી :

જેમા માઇક્રોસ્કોપિક ડિસેક્શન, ટેમ્પોરલ લોબ સર્જરી, લીજનેક્ટમી, લોબેક્ટમી, મલ્ટી લોબર સર્જરી, હેમી રફીઅરેક્ટમી જેવી વિવિધ સર્જરીથી ખેંચનું પૂર્ણ નિયમન લાવી શકાય છે.

(૨) નોનરિસેક્ટીવ ફંક્શનલ સર્જરી :

જેમા કોર્પસ કેલોઝોટોમી, મલ્ટીપલ સબપાયલ ટ્રાન્સેક્સન, સ્ટીરીઓ ટેક્ટિક પ્રોસિજર, ઓચોનાઈસિંગ, કમીસરોટોમી જેવી વિવિધ ફંક્શનલ સર્જરીથી ખેંચનું પૂર્ણ નિયમન લાવી શકાય છે.

(૩) સ્ટિમ્યુલેશન :

વેગસ નર્વ સ્ટિમ્યુલેશન, થેલેમિક સ્ટિમ્યુલેશન, સેરીબેલેર સ્ટિમ્યુલેશન જેવી વિવિધ સ્ટિમ્યુલેશન થેરેપીથી ખેંચના એટકની સંખ્યામાં અને કેટલાક કિસ્સામા ખેંચનું પૂર્ણ નિયમન લાવી શકાય છે.

⇒ કીટોજેનિક ડાયેટ :

- 80% ચરબીયુક્ત ખોરાક લેવાથી જેંચનું પ્રમાણ સારા પ્રમાણમાં ઘટે છે. તેવા સંશોધન પછી આ પદ્ધતિ પ્રચલિત થઈ છે. ખાસ કરીને અનિયંત્રિત જેંચવાળા બાળકોમાં વિશેષ ઉપયોગી થઈ છે. જેનાથી આશરે 30% બાળકો જેંચમુક્ત થયેલાં જણાયા છે અને એટલા જ બીજા દર્દીઓની જેંચ ઘણી ઘણી હોય તેવું જણાયું છે.
- આશરે એક થી બે વર્ષ સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ આવો ખોરાક લેવાથી સારુ પરિણામ મળી શકે.
- આમાં ભાતાપિતાએ પણ અગત્યનો ભાગ ભજવવાનો હોય છે. દર્દીને શરૂઆતમાં બે થી ત્રણ અછવાડીયા ડોક્ટરની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રાખવો હિતાવહ છે. યોગ્ય કિસ્સામાં આ પ્રકારની સારવાર જરૂરી અજમાવી શકાય.

(૩૫) શું વાઈની દવા આજીવન લેવી પડે છે ?

- વાઈ કથા પ્રકારની, કેટલા સમયથી, કથા કારણે થઈ અને જેંચ આબ્યા પછી દવા કયારે શરૂ કરી છે તેના ઉપર દવાના સમયનો આધાર રહેલો છે.
- સામાન્ય રીતે જેંચનો કોર્ઝ ત્રણ કે પાંચ વર્ષનો હોય છે.
- કેટલીક જટીલ પ્રકારની જેંચમાં આજીવન દવા લેવી હિતાવહ છે.

(૩૬) એપિલેપ્સીની સાથે અન્ય કોઈ બીમારી હોય કે થાય તો શું ધ્યાન રાખવું ?

- એપિલેપ્સીના દર્દીને દવા લાંબો સમય લેવાની હોય છે.
- એપિલેપ્સીના દર્દીને કોઈ મેડિકલ કે સર્જિકલ બીમારી થાય તો તેની દવા લેતી વખતે જેંચની દવા બંધ કરવી નહિકે પદ્ધત કરવી નહિ.
- અન્ય ડોક્ટરને બતાવવાનું થાય ત્યારે તમારી જેંચની દવાઓ પણ બતાવી હેલી.
- અન્ય ઓપરેશન કે મેડિકલ તપાસ કરાવતા પહેલા તમારી જેંચના નિધણાતની સલાહ લેવાનું ચુકશો નહિ.

(૩૭) એપિલેપ્સીના દર્દી ગર્ભધારણ કરી શકે કે નહિ ?

- એપિલેપ્સી ધરાવતી મહિલા ગર્ભધારણ કરી શકે.

- ગર્ભવિવસ્થા સમયે ખેંચ માટેની અમુક દવાઓના ઉપયોગથી આવનાર બાળકને મોટે ભાગે ક્ષતિ પહોંચતી નથી, જેમ કે કાબોમેઝેપિન.
- ગર્ભવિવસ્થા સમયે દવા બંધ કરી દેવાથી ખેંચ આવે તો તેમાં ઓક્સિજન ન મળવાથી બાળકને થતું નુકશાન વધુ ખરાબ પુરવાર થાય છે તેથી સલભગારીએ દવા અવશ્ય લેવી પડે.
- ગર્ભધારણા પહેલા તમારા ખેંચના નિષ્ઠાાતની સલાહ સૂચન લેવાનું ભૂલશો નહિ.

(૩૮) શું વાઈનો દર્દી કામ કે નોકરી કરી શકે નાહિ ?

- વાઈનો દર્દી કોઈપણ કામ કે નોકરી કરી શકે છે અને સફળ જીવન જીવી શકે છે.
- અમુક ખાસ પ્રકારની વાઈકી જેમાં તાણા કાબુમાં ના રહેતી હોય તેવા સંઝોગોમાં કામ કરવું જોઈએ નહિ.
- વાઈના દર્દીએ ડ્રાઇવિંગ, ભારે મશીનરીનું કામ, બાંધકામનું કામ અને જહાજ ઉપરનું કામ તેમજ અન્ય ભારે કામમાં જોડાવું જોઈએ નહિ.
- વાઈના દર્દીએ શારીરિક શ્રમ ઓછો પડે તેવું કામ પરંપરાવું જોઈએ.

(૩૯) એપિલેપ્સીના દર્દીને લાગણીઓની સમસ્યા થઈ શકે છે ?

- એપિલેપ્સીના દર્દીમાં ઉદાસીરોગ થવાની શક્યતા વધુ છે. ઉદાસીરોગ થવાનું કારણ રાસાયનિક ફેરફાર અને સામાજિક પરિબળ હોય છે.
- લાંબાગાળાની વારંવાર થતી ખેંચના દર્દીઓમાં સ્વભાવગત ફેરફાર થઈ શકે છે.
- કેટલાક દર્દીઓમાં મુડમાં બદલાવ, વિચારોમાં બદલાવ, ગુર્સો, ડર, ઉદાસિનતા અને ચિંતા જેવા લક્ષણો જોવા મળતા હોય છે.
- લાંબો સમય સુધી ચાલતી ખેંચના કારણે કેટલાક દર્દીઓમાં ખેંચ પછી વર્તનમાં ફેરફાર જેમ કે ધમાલ, તોફાન, ભાન ભૂલી જવું, ગાંડપણાના લક્ષણો પણ જોવા મળતા હોય છે.

- એપિલેપ્સીના દર્દીએ પોતાના રોગને સમજવો જોઈએ અને દવાઓ સમયસર લેવી જોઈએ.
- દર્દીએ સકારાત્મક ભાવ કેળવવો જોઈએ અને સકારાત્મક વિચાર, વર્તન માટેની પદ્ધતીઓ શીખવી અને અપનાવવી જોઈએ.
- લાગણીઓનો અતિરેક ને કારણો જેંચ આવી શકે છે.

એપિલેપ્સીથી ડર્યા કે શરમાચા કે પસ્તાવો કર્યા વગર તેનો સ્થિકાર કરો, સામનો કરો અને દવા નિયમિત લો અને સકારાત્મક જીવન જીવો.

(૪૦) જેંચ વખતે કોઈ બાબતોનું દ્યાન રાખવું જોઈએ ?

કોઈ વ્યક્તિને જેંચ ચાલુ હોય ત્યારે શું કરવું :

- શાંતિ જાળવો, નાહકની બુમાબુમ કે રોક્કળ કરશો નહિ.
- વ્યક્તિને ઈજા ન થાય તેનો જ્યાલ રાખો.
- જીબ દાંત વરચ્યે આવીના જાય તેની તકેદારી રાખો.
- વ્યક્તિ જમીન પર પટકાઈને પડે નહિ તેનું દ્યાન રાખો.
- વ્યક્તિના કપડા ઢીલા કરી દો. ચશ્મા, બેલ્ટ કાઢી નાખો.
- માથા નિચે તકીયો કે અન્ય ટેકો મુકો.
- અણિદાર કે ઘાતક વસ્તું ઓથી વ્યક્તિને દુર સુવાડો.
- જેંચ બંધ થઈ જાય પછી વ્યક્તિને સાઈડમાં સુવાડો.
- મોઢામાંથી ફીણા આવતું હોયતો સાફ કરો.
- તમારા નજીકમાં કોઈ ડોક્ટર હોય તો તરત જ તેમનો સંપર્ક કરો અને યોગ્ય સલાહ સૂચન મેળવો.

કોઈ વ્યક્તિને જેંચ ચાલુ હોય ત્યારે શું ન કરશો :

- નાહકની બુમાબુમ કે રોક્કળ કરશો નહિ કે ગભરાશો નહિ.
- મોઢામાં ચમચી, હાથ કે આંગળીઓ નાખશો નહિ.
- જેંચ વખતે વ્યક્તિના હલન ચલનને અટકાવશો નહિ કોઈ કષાર ફેકચર થઈ શકે.

- મોઢામાં કપડાનો ટુકડો નાખશો નહિ કારણ કે શાસ લેવામાં તકલીફ પડી શકે.
- બ્યક્ટિની આજુબાજુ ભીડ કે ટોળુ કરશો નહિ.
- બ્યક્ટિ પુરોપુરો ભાનમાં આવે પછી જ પણી કે અન્ય પીણુ આપવું.
- બ્યક્ટિ ખેંચ વખતે પકડવાની કોશિશ કરશો નહિ.

(૪૧) એપિલેસ્સીના દર્દીઓ કઈ કઈ બાબતોનું દ્યાન રાખવું ?

- પૂરતી ઉધ લો. નાહકના ઉજાગરા કરો નહિ.
- સમયસર પોષણાચુક્ત ભોજન લો. ઉપવાસ કરવા નહિ.
- તમને ખેંચ આવે ત્યારે શું કરવું તે તમારા પરિવાર અને મિત્રોને જણાવો.
- તાવ, શરદીમાં તરતજ દવા કરાવો, તાવના કારણો ઘણી વખત ખેંચ આવી શકે.
- કોમ્પ્યુટર, મોબાઇલ કે વિડીયો ગેમનો ઉપયોગ એકદારો લાંબા સમય સુધી કરવો નહિ.
- લાંબા સમય સુધી કે અંધારામાં ટીવી જોવાનુ ટાળો.
- ઓછા પ્રકાશમાં કામ કરવું નહિ.
- તમારા ડોક્ટરની સલાહ મુજબ હરરોજ સમયસર દવા લો.
- તમારી દવાઓ લેવાનું બંધ ન કરો, ડોઝ ન ચૂકો અથવા તમારા ડોક્ટરની સંમતિ વિના દવાનો ડોઝ ન બદલો.
- દવાની ભાંડ કે પ્રકાર પણ ડોક્ટરની સંમતિ વગર ન બદલો.
- તમે લઈ રહ્યા છો એ તમામ વર્તમાન દવાઓની ચાદી રાખો અને તે ડોક્ટરને બતાવો.
- દવાઓને સૂકી ઠંડી જગ્યાએ રાખો.
- તમારા ડોક્ટર સાથે ચર્ચા કર્યા વગર આર્થુ યેદિક તત્વો કે એન્ટાસિડ ન લો.
- આલ્કોહોલ તેમજ અન્ય કેફીદ્રબ્યનું સેવન ન કરશો.
- એકલા મુસાફરી કરવી નહિ કે વાહન ચલાવશો નહિ.

- દર્દીએ પોતાની ઓળખની એક નોંધ હંમેશા પોતાના પાસે રાખવી જેથી કોઈકવાર રસ્તામાં ખેંચ આવે તો તેની યોગ્ય સારવાર સરળતાથી થઈ શકે.

નામ :

સરનામુઃ :

ફોન નં. :

દવાનું નામ અને પ્રમાણા :

ડોક્ટરનું નામ :

ફોન નં. :

(૪૨) એપિલેપ્સી માટે કુટુંબીજનોએ શું કરવું ?

- કુટુંબીજનો વાસ્તવમાં દર્દી અને ચિકિત્સકને જોડતી ખુબ અગત્યની કડી છે.
- દર્દીને યોગ્ય નિધણાતની સારવાર લેવા સમજાવો.
- કુટુંબીજનો એ ચિકિત્સકને દર્દીની ખેંચ વિશે વિગતવાર માહિતી આપવી જોઈએ.
- દર્દી દવાઓ નિયમીત લે છે તેનું ધ્યાન રાખો.
- દવા લેવાથી કોઈપણ જાતની આડઅસર જોવા મળે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.
- ખેંચ માટે વારંવાર ડોક્ટર બદલવા કરતા યોગ્ય નિધણાત ડોક્ટરની દવા નિયમીત લેવાનો આગ્રહ રાખો.
- દર્દીને ખેંચની એક ડાયરી રાખો જેમાં ખેંચની નોંધ રાખો. જે તમારા ડોક્ટરને તપાસ વખતે માહિતગાર કરાવતા રહો.
- ખેંચ આવે ત્યારે પ્રાથમિક તબક્કામાં શું કરવું તેની માહિતી કુટુંબીજનો પાસે હોવી જોઈએ.
- દર્દીના શારીરિક, માનસિક, કૌટુંબિક અને અર્થિક હિતોનું રક્ષણ કરો.
- દર્દીને તેની ક્ષમતા પ્રમાણે કામ આપો, તેને તરછોડો નહિ, ટોકો નહિ.

(૪૩) એપિલેપ્સી માટે ફેમીલી ડોક્ટરે શું કરવું ?

- જેંચ વખતે બ્યક્ટિનોપ્સી સૌપ્રથમ ફેમીલી ડોક્ટર પાસે જતો હોય છે.
- ફેમીલી ડોક્ટર એપિલેપ્સી માટે તાલીમ પામેલા હોવા જોઈએ. ફેમીલી ડોક્ટર જેંચની પ્રાથમિક તબક્કાની સારવારની તાલીમ અને અનુભવ હોવો જોઈએ.
- જેંચ કાબુમાં આવ્યા પછી ફેમીલી ડોક્ટરે દર્દી અને તેના સગા સંબંધીઓને જેંચ વિશે સલાહ સૂચન કે માર્ગદર્શન આપી યોગ્ય સારવાર અને નિદાન માટે યોગ્ય વિશેષજ્ઞ પાસે મોકલવા જોઈએ.

(૪૪) એપિલેપ્સી માટે સામાજિક કાર્યકરે શું કરવું ?

- એપિલેપ્સી રોગ વિશે સામાજિક કાર્યકર પાસે પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.
- સામાજિક કાર્યકરે પોતાના કાર્યક્ષેત્રમાં એપિલેપ્સી માટે જાગૃતિ ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ.
- સામાજિક કાર્યકરે વારે તહેવારે પોતાના કાર્યક્ષેત્રમાં એપિલેપ્સી વિધેના કાર્યક્રમો અને શિબીરો યોજવી જોઈએ.
- સામાજિક કાર્યકરે પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ બ્યક્ટિનો જેંચની તકલીફ હોય તો તેમને યોગ્ય ચિકિત્સક ની સલાહ માટે પ્રોત્સાહિત કરવો જોઈએ.

(૪૫) એપિલેપ્સી માટે શૈક્ષણિક સંસ્થાઓ એ શું કરવું ?

- શૈક્ષણિક સંસ્થાઓએ એપિલેપ્સી રોગ વિશે વિધાર્થીઓને પ્રાથમિક જ્ઞાન આપવું જોઈએ.
- એપિલેપ્સી સામે વિધાર્થીઓમાં જાગૃતિ ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ.
- વારે તહેવારે સ્કુલો, કોલેજોએ નિષ્ઠાાત ડોક્ટરને બોલાવી એપિલેપ્સી વિધેના કાર્યક્રમો અને શિબીરો યોજવી જોઈએ.

(૪૬) એપિલેપ્સીની વાઈ સંબંધી કેટલીક ગેરમાન્યતાઓ કે અંધશ્રાદ્ધાઓ ?

- વાઈનો હુમલો ચાલુ હોય ત્યારે દર્દીના હાથમાં લોંડનો ટુકડો દબાવી રાખવો કે કુંગળી કે ચંપલ સુંઘાડવા. આમાન્યતા ખોટી છે. હકીકતમાં જેંચનો હુમલો એક થી પાંચ મીનીટમાં જાતે જ અટકી

જતો હોય છે.

- વાઈ વારસાગત છે. ના વાઈ વારસાગત નથી પરંતુ માતા પિતા બે માંથી કોઈને પણ વાઈ હોય તો જ બાળકને અન્ય બાળક કરતા વાઈ થવાની શક્યતા વધુ હોય છે.
- વાઈના દર્દી માટે શક્તિવર્ધક ટોનિક સારા. આ એક ગેરમાર્ગ દોરનારી માન્યતા છે.
- એક વાર વાઈથઈ એટલે હંમેશા થશે. ના એમ નથી. 71 % થી 75 % કેશમાં દવા લેવાથી 100 % રાહત થાય. કેટલાકને જુંદગીમાં એક જ વાર ખેંચ આવે છે.
- એપિલેપ્સી એ માતાના કેટેવના પ્રકોપથી થાય છે. ના, ખેંચ માટે આવી અનેક અંધશ્રેદ્ધાઓ અને લોકવાયકાઓ આપણા સમાજમાં પ્રચલિત છે. આ એક મગજની બિમારી છે. એટલે જ દોરા ધાગા કે બાધામાં પડ્યા વગર તેની યોગ્ય ડોક્ટર જોડે દવા કરાવો.
- એપિલેપ્સીના દર્દી જોડે લગ્ન ન કરાય. તદ્દન ખોટી વાત. ખેંચના દર્દી સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકે અને લગ્ન પણ કરી શકે.

(૪૭) એપિલેપ્સી જાગૃતિ કાર્યક્રમ, એપિલેપ્સી માટે જાગૃતિ ઉત્પન્ન થાય તે માટે દેશ વિદેશમાં વિવિધ કાર્યક્રમો, શિબિરો યોજવામાં આવે છે.

- પર્ફલ કે એપિલેપ્સી વિષેની જાગૃત માટે દુનિયાભારમાં 26માર્યના દિવસે ઉજવવામાં આવે છે.
- આપણા દેશમાં રાખ્ટ્રીય કક્ષાએ ઈન્ડિયન એપિલેપ્સી સોસાયટી, ઈન્ડિયન એપિલેપ્સી એસોસિએશન, વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો યોજે છે.
- આ સંસ્થાઓ રોગની માહિતી, આર્થિક સવલત, ગ્રૂપ કાર્યક્રમ, કેમ્પ અને શિબિરો જેવા વિવિધ કાર્યક્રમો યોજે છે.
- દર્દી તથા સ્વજનોને માનસિક સાંત્વના મળે અને સમાજમાં તેમને સ્વિકૃતિ મળે તેવી પ્રવૃત્તિઓ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ ઘરવામાં આવે છે.

સાનિદ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ



ડૉ. નિશાંત એ. સૈની

એમ. ડી. -સાઈક્યાટ્રી

- માનસિક અને મગજના રોગોના નિધણાત
- વ્યસનમુક્તિ સારવારના નિધણાત
- મનોજાતિય રોગોના નિધણાત (સેક્સ થેરાપીસ્ટ)
- બાળ માનસિક રોગોના નિધણાત

શૈક્ષણિક લાયકાત અને કારકિર્દીની અલાદાની જાહેરાત ::

- * એચ.એસ.સી.ઇ. (માર્ચ - ૧૯૯૮)
શ્રી વિવિધલક્ષી વિધામંડિલ, પાલનપુર
- * એમ.ડી.બી.ઓસ. (ઓક્ટોબર-૨૦૦૪)
બી.જે. મેડીકલ કોલેજ, સીવીલ હોસ્પિટલ, અમદાવાદ
- * એમ.ડી. સાઈક્યાટ્રી (મે-૨૦૦૮)
વી.એસ. હોસ્પિટલ, એન.એચ.એલ. મેડીકલ, કોલેજ, અમદાવાદ
- * રીસર્ચ આસીસ્ટન્ટ (મે-૨૦૦૫ થી ઓગસ્ટ-૨૦૦૮)
માનસિક રોગ વિભાગ, વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
- * આસીસ્ટન્ટ મનોચિકિત્સક અને રીસર્ચ આસીસ્ટન્ટ
(મે-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૦૮)
શ્રી કિઝનપ્રસાદ માનસિક રોગોની હોસ્પિટલ, અમદાવાદ
- * મુખ્ય મનોચિકિત્સક (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
ગાંધી લિંકન હોસ્પિટલ, ભણસાલી ટ્રૂસ્ટ, ડીસા
- * વ્યસનમુક્તિ નિધણાત (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
અફીણ મુક્તિ વિભાગ, ગાંધી લિંકન હોસ્પિટલ, ભણસાલી ટ્રૂસ્ટ, ડીસા
- * મુખ્ય મનોચિકિત્સક (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
આર.સી. પરીખ હોસ્પિટલ, ભણસાલી ટ્રૂસ્ટ, થરાદ
- * મુખ્ય મનોચિકિત્સક (સપ્ટેમ્બર -૨૦૦૮ થી જુન-૨૦૦૯)
શ્રી અને બાળરોગ હોસ્પિટલ, ભણસાલી ટ્રૂસ્ટ, રાધનપુર

- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૬ થી ઓગસ્ટ-૨૦૧૧)
મહેતા હોસ્પિટલ, સાંચોર
- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૬ થી ઓગસ્ટ-૨૦૧૦)
સાસગિરીશ્વર હોસ્પિટલ, સુમેરપુર.
- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૬ થી ઓગસ્ટ-૨૦૧૧)
શેરમહોમદ ડીસ્પેન્સરી, કાણોદર
- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૬ થી ઓગસ્ટ-૨૦૧૧)
સિવિલ હોસ્પિટલ, ગઢ-મડાણા
- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૬ થી ઓગસ્ટ-૨૦૧૧)
લાયન્સ હોસ્પિટલ, પાલનપુર

એવોઈ અને સંભાન

- નેશનલ ચંગ સ્કોલર એવોઈ ની પ્રથમ સ્પર્ધામાં ભારતમાં બીજા સ્થાને અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું. (ક્રીબ્લુઆરી-૨૦૦૮)
- ગુજરાત માલી ફેડરેશન દ્વારા ગુજરાતના માલી સમાજના પ્રથમ એકમાત્ર મનોચિકિત્સક માટે વિશિષ્ટ ગૌરવ સંભાન મેળવ્યું. (ક્રીબ્લુઆરી-૨૦૦૯)
- સૈની ક્ષેત્રિય (માલી) પંચાયત દ્વારા ગુજરાતના માલી સમાજના પ્રથમ એકમાત્ર મનોચિકિત્સક માટે વિશિષ્ટ મહાનુંભાવ સંભાન મેળવ્યું. (૨૦૦૮)
- ગુજરાત માલી ફેડરેશન અને મહાત્મા જ્યોતિબા કુલે સેવા સંસ્થાન દ્વારા ગુજરાતના માલી સમાજના પ્રથમ એકમાત્ર મનોચિકિત્સક માટે વિશિષ્ટ પારિતોષિક સંભાન મેળવ્યું. (ક્રીબ્લુઆરી-૨૦૧૧)

રીસર્ચ ::

- ગુજરાત ચુનિર્વસીટી અમદાવાદમાં ઉદાસી રોગ અને દીઘુવી ઉદાસી રોગનો અભ્યાસ કરી રિસર્ચ ક્ષેત્રે શરૂઆત કરી.
- ઉદાસી રોગથી પીડીત ગર્ભવતી રીતી અને ગર્ભસ્થ શીશુ ઉપર દૃવાઓની અસરો વિશે પેપર નેશનલ ચંગ સ્કોલર સ્પર્ધામાં રજુ કર્યું.

દ્રેફીનીંગ :

- વુડબ્રિજ મેન્ટલ હોસ્પિટલ સિંગાપોરમાં ઈન્ડો સિંગાપોર પી.જી.
ડેવલપમેન્ટ પ્રોગ્રામની તાલીમ મેળવી (જુન-૨૦૦૯)
- ગુડ કલીનીકલ પ્રેક્ટીસ આઈ.સી.એચ.જી.સી.પી. કોર્સની
તાલીમ કવીન્ટાઇલ્સ ઈન્ડીયા લીમીટેડ, લુન્ડબેક ઈન્ડીયા
લીમીટેડ, ફાઈઝર ઈન્ડીયા લીમીટેડ, ગ્લેક્સો સ્મીથ ક્રાઇન
લીમીટેડ, બિસ્ટલ મેયર સ્ટિકબ, સીરો ઈન્ડીયા લીમીટેડ,
આઈકોન કિલનિકલ રીસર્ચ અને જેન્સન જેવી ખ્યાતનામ
કંપનીઓ પાસેથી મેળવી.
- માનસિક રોગોના રીસર્ચના રેટીંગ સ્કેલની તાલીમ ફાર્મા સ્ટાર,
ગ્લોબલ લન્નિંગ, ચુનાઈટેડ બાયોસોર્સ, બાયોનીય, મેડિક્ટા અને
ફોરેસ્ટ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી
મેળવી છે.
- ઉન્માદ રોગના રીસર્ચની તાલીમ બાસીલોના, સ્પેન ચુરોપમાં
ફાઈઝર કંપની દ્વારા મેળવી (માર્ચ -૨૦૦૯)
- ઉન્માદ રોગના રીસર્ચની તાલીમ ગોવામાં બિસ્ટલ મેયર સ્ટિકબ
અને સીરો ઈન્ડીયા કંપની દ્વારા મેળવી (માર્ચ-૨૦૦૯)
- વિચારવાચુ સ્ટિક્ઝોફેનીયા રોગના રીસર્ચની તાલીમ સીંગાપોરમાં
જેન્સન એન્ડ જેન્સન કંપની દ્વારા મેળવી (ઓક્ટોબર-૨૦૦૯)
- ઉદાસી ડિપ્રેશન રોગના રીસર્ચની તાલીમ મલેશીયામાં લુન્ડબેક
કંપની દ્વારા મેળવી (ફેલ્લુઆરી-૨૦૦૮)
- વિચારવાચુ સ્ટિક્ઝોફેનીયા રોગના રીસર્ચની તાલીમ મલેશીયામાં
લુન્ડબેક કંપની દ્વારા મેળવી. (મે-૨૦૦૮)
- સમૃતિભંશ (ડિમેન્શીયા) રોગના રીસર્ચની તાલીમ ઈસાઈફાર્મા
કંપની અને આઈકોન કિલનિકલ રીસર્ચ દ્વારા મેળવી
(ઓક્ટોબર-૨૦૦૮)
- વિચારવાચુ સ્ટિક્ઝોફેનીયા રોગના રીસર્ચની તાલીમ થાઈલેન
માં લુન્ડબેક કંપની દ્વારા મેળવી. (ઓક્ટોબર-૨૦૦૮)
- એમ.ડી. સાઈક્યાટ્રી ની તાલીમ દરમિયાન વિવિધ ફેઝ-I, ફેઝ-II,
ફેઝ-III, ફેઝ-IV અને રેગ્યુલેટરી રીસર્ચમાં પણ
સબઈન્યેસ્ટીગેટર અને મુખ્ય રેટર તરીકે રહેલ છે.

સાનિદ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ

ઉપલબ્ધ સારવાર સુવિધાઓ :

● માનસિક રોગો :

ઉદાસીનતા, હતાશા, નિરાશા (ડિપ્રેશન) તણાવ, ચિંતા, ફડકી, તીવ્ર ઉશ્કેરાટ, કોઘ, અકારણ, ગુસ્સો, ઉનમાદ, એકજ વિચાર કે કિયાનું પુનરાતર્વન (ઓ.સી.ડી.), અનિંદ્રા, અતિશોક, વિલાપ, શંકા, વહેમ, ડર, બિક, વિચારવાચ્ય (સ્કીઓફેનિઅન), હિસ્ટેરીયા, આપદ્ધાતના વિચારો, પાગલપન, વળગાડ કે બકવાસ કરવો જેવા માનસિક રોગોની સચોટ સારવાર.

● મગજના રોગો :

ચકકર આવવા, ભૂલવાની બિમારી, સ્મૃતિલ્ખંશ (ડિમેન્ડિઅન), કંપવાત (પાર્કિન્સોનિઝમ), ધૂમારી, જાનતંતુ અને મગજની નશોની તકલીફો, શરીર ના હલચ ચલન ને લગતા રોગો ની સલાહ સારવાર.

● હેંડેક કિલનીક :

માથાનો દુખાવો, શિરદઈ, આધાશીશી, માઇચ્રેન, વાસ્ક્યુલર હેંડેક, ટેન્શન હેંડેક, કલસ્ટર હેંડેક, માથાની બળતરા, લાંબા સમયનો માથાનો દુખાવો, મગજ અને માથાના વિવિધ પ્રકારના દુખાવા, ગરદન અને મોઢાના દુખાવા, ટ્રાઇજિમિનલ ન્યુરાલિઝિઅની સારવાર.

● એપિલેપ્સી કિલનીક :

વાઈ, ખેંચ, તાણ, એપિલેપ્સી નું સચોટ નિદાન, સલાહ સારવાર.

● વ્યસનમુક્તિ કેન્દ્ર :

દાડુ, અફીણા, ડોડા, ભાંગ, ચરસ, ગાંઝો, તમાકુ, બીડી સિગારેટ, નશીલી ઉધની દવાઓ જેવા વ્યસન માટે વ્યસનમુક્તિ સલાહ સારવાર.

- **બાળ માનસિક રોગ સારવાર :**
મંદબુદ્ધિ, બેદ્યાનપણું, અનીંદ્રા, ચમકી જવું, પેશાબની તકલીફો, ચંચળતા, અતિશાય તોકાન, કોઘ, કોઈનું કહેવું ન માનવું, ભણવામાં પાછા પડવું, ચાદ ન રહેવું, હતાશા, વિચારવાચું, વિશીષ્ટ શિખવાની સમર્સ્યાઓ માટે સલાહ સારવાર.
- **એકેકેમીક ગાયડન્સ કિલનીક :**
શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરીયર એકેકેમીક સ્કોલેટીક ગાયડન્સ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ.
- **સાઇકોસેક્સુઅલ કિલનીક :**
સેકસ રોગો મનોજાતિય રોગો માટે સલાહ સારવાર માર્ગદર્શન.
- **કાઉન્સેલિંગ સેન્ટર :**
સાઇકોથેરેપી સીરીંગ, ગૃપ થેરેપી, ફેમીલી થેરેપી, મરાઈટલ કાઉન્સેલિંગ, બીહેવીયર થેરેપી, કોઝીટીવ થેરેપી અને વિવિધ સાઇકોથેરેપી સારવાર.
- **જીરીઆટ્રીક સાઇક્યાટ્રીક કિલનીક :**
પૃધા અપસ્થા ની માનસિક બિમારીઓ જેમ કે ઉદાસીનતા, વિચારવાચું, અલિંદ્રા સ્મૃતિભંશ, ભૂલવાની બિમારી, ઉન્માદ, બકવાસ કરવો, માથું દુખવું, ચક્કર કે ખેંચ જેવા રોગોની સારવાર.
- **હિનેર્ડલ સાઇક્યાટ્રીક કિલનીક :**
માસિકની શરૂઆત કે મેનોપોઝ તેમજ પ્રસુતિ દરમિયાન કે પછી થતી માનસિક બિમારીઓની સારવાર જેમ કે અકારણ ચીડીયાપણું, કોઘગુસ્સો, ઝડી વલણ કે સ્વભાવ, હતાશા, નિરાશા, ઉદાસીનતા, ચિંતા, શરીરની બળતરા કેદુખાવો, માથું દુખવું, ડર, ભય, શંકા, વહેમ, ઉંઘની અનિયમીતતા, માથું દુખવું જેવા લક્ષણોની સારવાર.

- ઓનેરીટી કિલનીક :

સાનિધી ફીડ્ઝિયોથેરેપી એન્ડ ફીટનેસ સેન્ટરમાં અત્યાધુનિક સાધનો દ્વારા વજન ઉતારવા ફીટનેસ માટે અને સ્લીમીંગ તેમજ વેલનેસ માટે સલાહ સારવાર સુવિધા ઉપલબ્ધ છે.

- માનસિક રોગ સલાહ સારવાર કેન્દ્ર :

માનસિક અને ભગજના રોગો વિષે મુંજવતા પ્રશ્નો માટે યોગ્ય સલાહ, માર્ગદર્શન, નિદાન અને સારવાર.

- ઈમરજન્સી સારવાર :

૨૪ કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે.

(MO. 94299 22066, MO. 93762 14111)

First Aid for Seizures

(Convulsions, generalized tonic-clonic, grand mal)




Cushion head,
remove glasses



Loosen tight clothing




Turn on side



Time the seizure with
a watch



Don't put anything
in mouth



Look for I.D.



Don't hold down



As seizure ends...



...offer help

સાનિધ્ય માનસિક રોગોની હોસ્પિટલ
સાનિધ્ય વ્યસન મુક્તિ કેન્દ્ર
સાનિધ્ય સાઇકોથેરાપી સેન્ટર
સાનિધી ફીડીયોથેરાપી અને ફીટનેસ સેન્ટર

ડૉ. નિશાંત એ. સૈની

એમ.ડી. સાઇકયાદ્રી

ફોન: (૦૨૭૪૨) ૨૫૭૬૬૬
 મો. ૯૪૨૬૬ ૨૨૦૬૬
 મો. ૯૩૭૬૨ ૧૪૧૧૧
 મો. ૯૪૨૬૫ ૧૭૬૬૬

ડૉ. પ્રિયંકા એન. સૈની

બી.પી.ટી.એમ.આઈ.એ.પી.
 મો. ૯૪૨૬૬ ૨૨૦૭૭

સાઇકોલોજીસ્ટ

રાજેશ ભુતડીયા

એમ.એ. સાઇકોલોજી, પી.જી.ડી.આર.પી.
 મો. ૯૪૨૬૧ ૯૩૫૦૮

-: મેનેજુંગ ડીરેક્ટર :-

કમલેશભાઈ પટેલ મો. ૯૪૨૮૫ ૫૮૬૭૮

-: હોસ્પિટલ લેલ્વલાઈન :-

જયેશભાઈ સોલંકી મો. ૯૯૭૪૧ ૦૨૩૬૭

સાનિદ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ

ડૉ. નિશાંત એ. સૈની

એમ. ડી. -સાઇક્યાટ્રી

- માનસિક અને મગજના રોગોના નિષ્ણાત
- વ્યાસનમુક્તિ સારવારના નિષ્ણાત
- મનોજાતિય રોગોના નિષ્ણાત (સેક્સ થેરાપીસ્ટ)
- બાળ માનસિક રોગોના નિષ્ણાત

સ્થળ :

નીજો ભાગ, સાંદ્ય કોમ્પ્લેક્સ, ગોબરી રોડ, ગઠામણ દરવાજા,
પાલનપુર - ૩૮૫૦૦૧


સંપર્ક :

ફોન :: 02742 - 257666

મોબાઈલ :: 94299 22066

મોબાઈલ :: 93762 14111

ઇમેઇલ :: sanidhyapsychiatrichospital@yahoo.com



November is
Epilepsy Awareness Month

Four black ribbon icons are arranged around the text. One ribbon is positioned to the left of the word "November", one to the right of "Epilepsy", one below "Awareness", and one above "Month".

એપિલેપ્સી વાઈ, ઝેંચ, તાણા, આંચકી, મીરગી, કન્વલગન અને ફિટ
જેવા વિવિધ નામે ઓળખાય છે.

એપિલેપ્સી એટલે વારંવાર આવતી ઝેંચ. એક જ વાર આવેલી ઝેંચને
એપિલેપ્સી કહેવાય નહીં.

વાઈ એ મેલી શક્તિઓ, વળગાડ કે પ્રકોપ થી થતો રોગ નથી. આ
મગજનો એક પ્રકારનો રોગ છે.

આજના આધુનિક યુગમાં એપિલેપ્સીની સારવાર શક્ય છે.

એપિલેપ્સીથી ડયક્લિ શરમાયા કે પસ્તાવો કર્યા વગર તેનો સ્વિકાર કરો,
સામનો કરો અને દવા નિયમિત લો અને સકારતમક જીવન જીવો.

એપિલેપ્સી ભાટે કોઈપણ રિપોર્ટ કરાવતા પહેલા તમારા ડોક્ટરની
સલાહ લેવાનું ચુકશો નહિ.

એપિલેપ્સીને સમજુએ અને તેની યોગ્ય સારવાર કરવાનો પ્રયાસ
આજથી કરીએ

સાનિદ્ધ માનસિક રોગોની હોસ્પિટલ

બીજો માળ, સાંદ કોમ્પ્લેક્ષન, ગોબરી રોડ, ગઠામણ ગેટ,
પાલનપુર - ૩૮૫૦૦૧

કલીનીક :: ૦૨૭૪૨ - ૨૫૭૬૬૬

મોબાઇલ :: ૯૪૨૯૯ ૨૨૦૬૬

મોબાઇલ :: ૯૩૭૬૨ ૧૪૧૧૧